

PSL/CS/SE/REG-47/24-25
13th May, 2024

Corporate Relationship Department
BSE Limited
1st Floor, P. J. Towers
Dalal Street,
Mumbai - 400 001.

COMPANY CODE NO:-4166 (SCRIP CODE : 513511)

Sub: Publication of extract of Audited Financial Results for the quarter and financial year ended 31st March, 2024

Ref: Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015

Dear Sir,

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the newspaper clippings of the extract of the Audited Financial Results of the Company for the quarter and financial year ended 31st March, 2024 published on 13th May, 2024 in Indian Express & Business Standard (English) and Financial Express & Loksatta-Jansatta (Gujarati).

You are requested to kindly take the above on your records.

Thanking You,


Yours faithfully
For **Panchmahal Steel Limited**

Deepak Nagar
GM (Legal) & Company Secretary

E-mail : shares@panchmahalsteel.co.in

Encl : as above


CROSSWORD 5362




- ACROSS**
- One who wallows in merrymaking? (8)
 - It's not profitable for a company to make it (4)
 - Forms groups of actors (5)
 - Don't stop the wrong persons (5,2)
 - One objecting to modern arts movement (12)
 - Many invited to a kind of ball (6)
 - Stay over with the French in order to eat (6)
 - Not to be found in a minute (3,3,6)
 - About to be put back in school ground? (7)
 - Sarcasm from the club youth leader (5)
 - Fishes in the sunshine? (4)
 - Graved? (8)
- DOWN**
- People in the running (4)
 - Partly improves personal service? (7)
 - Panic at having a capital loss? (4,4,4)
 - Reveal a former attitude (6)
 - Notes wrong beginning (5)
 - Men ordered to guard the southern gates? (8)
 - 8 (Scamilee) part on record perhaps (12)
 - I am getting stout as a business man (8)
 - No hand disturbs such a light sleeper (4,3)
 - The critical point in eating a biscuit? (7)
 - Transfer between banks (5)
 - Looks at a key agreement (19)

Solutions Crossword 5361 Across: 1 Brawl, 2 Top, 3 Ocean, 4 Prowl, 5 To, 6 Skunk, 11 Siding, 12 Harrier, 13 Harem, 14 Honey, 20 Honey, 21 Honey, 22 Bee, 23 Defendant, 24 Owl, 3 Biker, 4 Thugs, 5 Pines, 6 Pines, 7 Arrows, 11 Archival, 13 Milk, 14 Grocery, 16 Soccer, 17 Milk, 18 Green

OVER THE HEDGE by Michael Fry & T Lewis



CALVIN & HOBBS by Bill Watterson



MARVIN by Tom Armstrong



JUMBLED WORDS

Given below are four jumbled words. Solve the jumbles to make proper words and move them to the respective squares below. Select the letters in the shaded squares and jumble them to get the answer for the given word. Conquer, but don't... Marie von Ebner-Eschenbach (7)

HRSIR **GOORMP**

ILPTU **HORNET**

© 2024 Indian Express. All rights reserved. No part of this publication may be reproduced, stored in a retrieval system, or transmitted in any form or by any means, electronic, mechanical, photocopying, recording, or otherwise, without the prior written permission of the publisher.

SUDOKU 5560

Difficulty Level: 1s Instructions: To solve a Sudoku puzzle, every digit from 1 to 9 must appear exactly once in each of the nine horizontal rows and in each of the nine boxes.

Difficulty Level: 1s = Very Easy; 2s = Easy; 3s = Medium; 4s = Hard; 5s = Very Hard; 6s = Genius

8	7	1		2				
	1		5		3			
5	2	8		6	7			
	2	2		9	1			
4	8	3		3				
8	1		4	2	5			
3	6		4					
9			1	3	7			

SOLUTION SUDOKU 5559

8	3	4	6	5	2	9	1	7
6	5	2	7	1	9	3	4	8
1	9	7	8	4	3	5	6	2
7	6	3	2	9	8	1	5	4
5	2	9	1	6	4	7	8	3
4	1	8	5	3	7	2	9	6
3	4	6	9	7	5	8	2	1
9	8	1	3	2	6	4	7	5
2	7	5	4	8	1	6	3	9

DAY TODAY

BY PETER VIDAL

- ARIES (Mar 21 - Apr 20)**
Another week, another Monday, and what this means for you is a sensible efficient and organised beginning. The Moon is in a supportive mood, so everything needs to be taken one step at a time.
- TAURUS (Apr 21 - May 21)**
Six out of a possible ten planets are in directly supportive positions, backing your interests. That's not a bad tally! You should be able to take life at your own pace today, so anyone who tries to pressure you could be out of luck. Make the most of any passing good fortune.
- GEMINI (May 22 - June 21)**
Home and domestic matters are bound to take up a fair bit of your time, and even if you're at work, the best way to get on with colleagues will be to imagine you're all part of one big family. Not a perfectly happy one necessarily, but a family nonetheless.
- CANCER (June 22 - July 23)**
Male serious plans and take practical decisions. It has never been more important to look out at the significant details and put all your hopes, wishes and fantasies to one side. Don't be perturbed by delays. But do keep a very close watch on every detail concerning cash.
- LEO (July 24 - Aug 23)**
Although you may be preoccupied with the trivia of material survival, dwelling over questions such as how to save the old world and how to save the new, this is in fact a somewhat optimistic and adventurous time. All that is asked of you is that you take the right decisions.
- VIRGO (Aug 24 - Sep 23)**
The Moon is well situated, strong and sympathetic. This is a welcome symbolic indication that you can have it all your own way at home, but only if you face up to hidden problems and deep undercurrents. People who think differently should soon be made to apologise for their errors.
- LIBRA (Sep 24 - Oct 23)**
Something secret could be bothering you today just what this could be is far from clear, but it could be connected with regret for affairs which didn't work out. Stop being such a perfectionist and realise that you can't revise the past - at least, not now.
- SCORPIO (Oct 24 - Nov 23)**
Social influences are looking very pronounced today. If a little serious, take life at your own pace now seems to be a sense that they're going to look after you, or provide emotional security. I know this may be asking too much, but I'm sure you can cope.
- SAGITTARIUS (Nov 24 - Dec 22)**
Career and professional affairs now require their fair share of attention, although more now seems to be a sense that they're going to look after you, or provide emotional security. I know this may be asking too much, but I'm sure you can cope.
- CAPRICORN (Dec 23 - Jan 20)**
After last week's energetic start, this week's gear: You may therefore feel that you have a right to sit down and put your feet up, but any spare time is likely to be disrupted by the need to swing straight back into action.
- AQUARIUS (Jan 21 - Feb 19)**
You still seem to be imagining nobody else understands you. The key is to listen very carefully to what your imagination is trying to tell you rather than time. All that is asked of you is that you take the right decisions.
- PISCES (Feb 20 - Mar 20)**
You always find criticism difficult, for you allow it to undermine your confidence. However, nothing would do you more good at the present time than a little friendly advice. Romantically, by the way, you could soon be on to a total winner.

HINDUSTAN PETROLEUM CORPORATION LIMITED
CIN: L23201MH1952GQI08858

Regd. Office: Petrolium House, 17, Janshodhi Tale Road, Churhagale, Mumbai - 400 020
Tel: +91 - 22 - 22683900. Fax: +91 - 22 - 22872992
Website: www.hindustanpetroleum.com, Email: hpi.investors@mail.hpl.co.in

NOTICE TO MEMBERS - POSTAL BALLOT
Notice is hereby given to the Members that pursuant to Section 106 and Section 110 of the Companies Act, 2013 ("the Act") read with Companies (Management and Administration) Rules, 2014 ("the Rules"), the Company is seeking approval of Members of the Company through the Postal Ballot Process by passing of Ordinary Resolution in compliance of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI LODR, 2015") to Capitalize the Reserves of the Company and to Issue Bonus Shares.

In compliance with addressal statutory provisions, MCA circulars issued in this regard and Regulation 44 of SEBI LODR, 2015, Postal Ballot Notice has been sent out through electronic mode and remote e-voting facility has been facilitated through MCA Central Depository Services (India) Limited ("CDSL"). Further, the notice has been dispatched on Saturday, May 11, 2024 only to those Members whose email addresses were registered with the Company Depository Participant ("DP") on Friday, May 10, 2024. A person who is not a Member as on the cut-off date should treat the Notice of Postal Ballot as information and not as an offer to subscribe for shares.

The Notice of Postal Ballot which, inter-alia, includes detailed procedure is hosted under the Investors' section on the Company's website www.hindustanpetroleum.com and on the website of CDSL at <https://www.evotingindia.com> and shall also be informed to BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") at www.bseindia.com and www.nseindia.com respectively.

e-Voting: Summary of relevant dates for remote e-voting process is given below.

Commencement of remote e-voting	Monday, May 13, 2024 (18:00 a.m. IST)
End of remote e-voting	Tuesday, June 11, 2024 (18:00 a.m. IST)
Cut-Off Date for remote e-voting	Friday, May 10, 2024
Results of remote e-voting	After before 4.00 p.m. IST on Wednesday, June 12, 2024
Event Number for remote e-voting	EVGN-24031001

- Please note that e-Voting Module will be disabled by CDSL for remote e-voting after the said date/time.
- Members holding shares as on cut-off date i.e. May 10, 2024 can access Notice of Postal Ballot on HPC's website www.hindustanpetroleum.com documents/pdf/Notice-of-Postal-Ballot_2024.pdf and can refer instructions given in the Notice to the Notice of Postal Ballot for obtaining User ID and password for remote e-voting.
- Members holding shares in physical mode and who have not updated their e-mail addresses with the Company are requested to write to the Company or Registrar and Transfer Agents (M/s. Link Intime India Private Limited, Link Intime India Private Limited, C/O. 11, Bandra Kurla Complex, 11, Bandra Kurla Complex, Mumbai - 400 050, email: link.intime@linkintime.com) to update their respective email addresses by providing the requisite documents, members holding shares in dematerialized mode are requested to register/update their email addresses with the respective Depository Participants.
- The Company has appointed M/s. Rajni Chokshi & Company, Practising Company Secretaries, as the Sponsorizer for conducting the Postal Ballot Process in a fair and transparent manner.
- All grievances related to the facility for e-voting by electronic means may be addressed to Mr. Rakesh Dam, Sr. Manager, Central Depository Services (India) Limited, Wing 25th Floor, Market Floor, Market Floor, Market Floor, 17, Janshodhi Tale Road, Churhagale, Mumbai - 400 020, or send an email to helpdesk.evoting@indiaidm.com or call at 1800 22 55 55.
- Members having grievances pertaining to the Postal Ballot Process, may send an e-mail at hpi.investors@mail.hpl.co.in or write to Shri Umesh S. Pawasakar, Assistant Company Secretary of Shares Department, Hindustan Petroleum Corporation Limited, 2nd Floor, Shares Department, Petrolium House, 17, Janshodhi Tale Road, Churhagale, Mumbai - 400 020. The Notice can also be downloaded from the Investor section on www.hindustanpetroleum.com and the website of CDSL at <https://www.evotingindia.com> respectively and on the website of BSE at www.bseindia.com and also be hosted under the Investors section of website of National Stock Exchange of India Limited.

Bonus Issue, Record Date & Mode of Allotment Details are as under:

Ratio: 11 shares for every 2 shares held (subject to approval of the shareholders through Postal Ballot)

Record Date for eligibility to receive Bonus Equity Issue: Friday, June 21, 2024

Allotment of Bonus Equity Shares: In Demat Mode

Date: May 12, 2024 **By Order of the Board,**
Place: Mumbai **V. Murali**
Company Secretary

S E L A N
EXPLORATION TECHNOLOGY LIMITED

8th Floor, Imperia Innspac, Golf Course Extension Road, Sector - 62, Gurgaon - 122002, Haryana, E-mail: commercial@selan.com

EXPRESSION OF INTEREST FOR SALE OF NATURAL GAS AND OIL / CONDENSATE FROM SELAN'S OIL & GAS CONTRACT AREAS LOCATED IN CAMBAY BASIN AROUND SURAT, GUJARAT, INDIA.

Selan is the operator of E&G blocks under contracts signed with Ministry of Petroleum and Natural Gas, Government of India. The E&G blocks is located around Surat district in Gujarat, Selan is the operator of three producing offshore Oil & Gas Contract Areas, viz. Baral, Lohar and Kachar under contracts signed with Ministry of Petroleum and Natural Gas, Government of India.

In line with the "Natural Gas Marketing Reforms" notification issued by Ministry of Petroleum and Natural Gas on 15th October, 2023 and detailed guidelines issued on 3rd December, 2023 as "Discovery of Market Price for Domestically Produced Natural Gas through e-auction", Selan is planning to conduct an online competitive auction for the sale of natural gas from the E&G Contract Areas.

Operator seeks an Expression of Interest (EOI) from interested oil / condensate consumers for purchase of the oil / condensate available from E&G Contract Areas. The expected volume is 100 bopds. The interested bidders are requested to revert on commercial@selan.com by 3 June, 2024 indicating their oil / condensate volume requirements.

Operator seeks an Expression of Interest (EOI) from interested oil / condensate consumers for purchase of the oil / condensate available from E&G Contract Areas. The expected volume is 100 bopds. The interested bidders are requested to revert on commercial@selan.com by 3 June, 2024 indicating their oil / condensate volume requirements.

Responses submitted through agents/intermediaries will not be considered.

Access to site for submitting EOI and providing details will not give any prescriptive right to the participant for the allocation of gas and/or oil/condensate. Also, Selan reserves the right to accept or reject the EOI and no communication in this regard shall be entertained from the bidders.

"IMPORTANT"

Whilst care is taken prior to acceptance of advertising copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals advertising in its newspapers and Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with advertisers or otherwise acting on an advertisement in any manner whatsoever.

SALUTE THE SOLDIER

Constable Surender Singh

ITBP salutes its braveheart Constable Surender Singh of 4th Battalion, who made supreme sacrifice in the line of duty on this day in Jammu & Kashmir in 2002.

Resident of: Villu - Kandote, Post - Nodinala, Distt. - Doda, State- Jammu & Kashmir.

indianexpress.com

Panchmahal Steel Limited

Registered Office: GDC Industrial Estate, Kalol-389 330, Dist. Panchmahals, Gujarat
CIN: L27104GJ1972PLC002153. Phone No: 02676-73777. Fax No: 02676-230889
Email: shares@panchmahalsteel.co.in Website: www.panchmahalsteel.co.in

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31st MARCH, 2024

Sr No	Particulars	Quarter ended		Year ended	
		31-03-2024	31-12-2023	31-03-2023	31-03-2024
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)
1	Total Income	9,957.26	10,422.82	13,005.10	43,186.14
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	324.54	(44.03)	149.26	391.88
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	324.54	(44.03)	149.26	391.88
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	244.47	(32.25)	107.58	296.92
5	Total Comprehensive Income for the period [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	243.74	(26.12)	141.32	305.58
6	Equity Share Capital	1,907.83	1,907.83	1,907.83	1,907.83
7	Reserves excluding Revaluation Reserve	13,781.06	13,781.06	13,781.06	13,781.06
8	Earnings Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations)				
	a) Basic	1.28	(0.17)	0.56	1.56
	b) Diluted	1.28	(0.17)	0.56	1.56

Note: The above is an extract of the detailed format of Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results is available on the website of Stock Exchange at www.bseindia.com and also on the Company's website at www.panchmahalsteel.co.in

Place: Vadodara **By order of the Board**
Date: 11-05-2024 **Ashok Malhotra**
Chairman & Managing Director
DIN - 00120196

I arrive at a conclusion not an assumption.

Inform your opinion with detailed analysis.

The Indian Express.
For the Indian Intelligents.

The Indian EXPRESS
JOURNALISM OF COURAGE

कॅनरा बँक Canara Bank

ARN BRANCH - MUMBAI
37, Kharavela, Opp. Patkar Hall, New Marine Lines, Therokeya Marg, Mumbai - 400020.
Email: cti@360canara.com | www.canara.com

SALE NOTICE

E-Auction Sale Notice for Sale of Immovable Properties under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provisions Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrowers(s) and Guarantor(s) that the below described immovable properties mortgaged/charged to the Secured Creditor, the Possession of which has been taken by the Authorized Officer of Canara Bank, will be sold on "As is where is" & "As is what is" basis on **29.05.2024** for recovery of Rs. 9,01,18,20,000/- (NINE CRORES AND TWENTY LAKHS AND TWENTY THOUSAND) due to the ARN Branch of Canara Bank from M/s. Kavita Auxiliaries Pvt. Ltd. represented by its Director and Guarantors Mr. Vishvas R. Gajjar and Mrs. Parul Vishvas Gajjar.

Sr. No.	Description of the Property	Reserve Price	Earnest Money Deposit
1.	Flat No. 202, (Merged with Flat No. 201) 2nd Floor, Building named "Patriharan" Plot No. 2, Survey No. 61(P), Shivasa-Khambur Road, Near Khambur Road, Near Hotel Som Inn & Holy Child School Village Saranavasi, Shivasa, Dadra Nagar, Haveli (UT) Shivasa - 396203.	Rs. 65,00,000/-	Rs. 7,36,500/-
2.	Flat No. 201, (Merged with Flat No. 202) 2nd Floor, Building named "Patriharan" Plot No. 2, Survey No. 61(P), Shivasa-Khambur Road, Near Khambur Road, Near Hotel Som Inn & Holy Child School Village Saranavasi, Shivasa, Dadra Nagar, Haveli (UT) Shivasa - 396203.	Rs. 85,00,000/-	Rs. 1,55,000/-
3.	Industrial Gaita No. 102, (Merged with Gaita No. 111) 1st Floor, "B" wing, Building Named "Electronic Industrial Estate" Near 66 KVA Road, & Sachivlay, Village-Annai, Dadra & Nagar, Haveli (UT) Shivasa.	Rs. 40,23,000/-	Rs. 4,02,300/-
4.	Industrial Gaita No. 111, (Merged with Gaita No. 102) 1st Floor, "B" wing, Building Named "Electronic Industrial Estate" Near 66 KVA Road, & Sachivlay, Village-Annai, Dadra & Nagar, Haveli (UT) Shivasa.	Rs. 37,53,000/-	Rs. 3,75,300/-
5.	Gaita No. A/3, Ground Floor, Survey No. 66/1, Building named "Dhanudyog Sahakar" Near Lila Village Pipara Anai, Shivasa - 396230.	Rs. 11,30,000/-	Rs. 11,30,000/-
6.	Flat No. 303, Building No. E of "Shree Padmanav Vilas" Surbentkan Society, S.No. 102/2, Shivasa Dadra & Nagar Haveli (U.T)	Rs. 45,00,000/-	Rs. 4,50,000/-

The Earnest Money Deposit shall be deposited on or before **28.05.2024** upto 5 p.m. (EST) amount of 10% of the Reserve Price is to be deposited by way of Demand Draft in favour of Authorized Officer, Canara Bank ARN 1 Branch Mumbai or shall be deposited through RTGS/NEFT/Funds Transfer to credit account of Canara Bank ARN 1 Branch Mumbai A/c No. 209272434 IFSC Code CNBR020360 on or before **28.05.2024** upto 5.00 p.m. and other documents to be submitted to service provider on or before **28.05.2024** upto 5.00 p.m. Date to which documents can be deposited with Bank is **28.05.2024**.

Dated 13/05/2024 at Mumbai.

For detailed terms and conditions of the sale, please refer the link "E-Auction" provided in Canara Bank's website (www.canarabank.com) or may contact Dr. Sneha Sankaran, Chief Manager, Canara Bank, ARN 1 Branch, Mumbai (Ph. No. 022-2206425/30 Mob. No. 982596349) Mr. Deepak Kumar, Sr. Manager (Ph. No. 989278759) e-mail id: cti@360canara.com during office hours on any working day or the service provider M/s. C1 India Pvt. Ltd., Uddeg Village, Phase - 2, Gul Petchem Building, Building No. 301, Gurgaon, Haryana. Pin-122015 Contact Person Mr. Shivak Prasad Mob. No. 8866682937 Contact No. +91 2443000291 2223224, support@bankauctions.com; maharashtra@ctiindia.com

Sd/-
Authorized Officer
Canara Bank, ARN 1 Branch
Place: Mumbai

Companies, Insight Out

Companies, Monday to Saturday

To book your copy, sms reachbts to 57575 or email order@bsmail.in

Business Standard
Years of Insight

PUBLIC NOTICE FOR ISSUANCE OF TITLE CLEARANCE CERTIFICATE

Notice is hereby given to all concerned that my client namely **DHARMENDRAKUMAR MOHANBHAI PATEL** has approached to the Title Clearance certificate in respect of the immovable Property Tenement No. 1006/1/708/0, Property No. 320 bearing Tenure 'A' land being City Survey No. 04/048/3, Sheet/Tika No. 04, measuring 323.69 Sq. Mtrs. and Situated on the Gamtal land in the locality known as Kolivad, Kalyawadi, within the limits of Navari-Vijapur Nagarapalika, Tal. & Dist. Navsari. He claims to be the lawful owner and person in possession and occupation of the said property. That my said client is desirous to avail the loan facilities from the nationalized bank by mortgaging the said property and he has requested me to issue the Title Investigation Report in respect of the aforesaid property.

Therefore, if any person, firm, company, Govt. or Semi-Govt. body has any right, title or interest of any nature on and over the said property of any part thereof or the said property is mortgaged with them, they are hereby called upon by this notice to lodge their claim, if any, with supporting documentary evidence in the undersigned within a period of 7 (seven) days from the date of publication of this notice failing which it will be presumed that nobody has any right of any nature and if there be any, have abandoned the same and after notice period, the title clearance certificate in respect of the said property will be issued in favour of my client.

D. 11-05-2024
Nitesh T. Champaneri (Advocate)
116 First Floor, Bharan Bhilai Complex, Opp. Bank of Baroda, Pashchim, Navsari, Ms. 391010 (20)

IDFC First Bank Limited
(Formerly known as IDFC Bank Ltd) | CIN : L65107N2014PLC937792
Registered Office - KRM Towers, 7th Floor, Harrington Road, Chetpet, Chennai-600031. Tel: +91 44 4584 4000 | Fax: +91 44 4564 4022

APPENDIX - IV - A [See provision to rule 8 (6) & 9 (1)] SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) & 9 (1) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s), Co-Borrower(s) and Guarantor(s) that the below described immovable properties as per column (i) mortgaged/charged to the Secured Creditor, the possession of which has been taken by the Authorized Officer of Formerly known as IDFC Bank Ltd, will be sold on "As is what is" & "Whatever there is" on 30-May-2024 as described hereunder, for the recovery of amount due to IDFC FIRST Bank Limited (Formerly known as IDFC Bank Ltd) from Borrower(s) and Co-Borrower(s) as per column (ii).

For detailed terms and conditions of the sale, please refer the link provided in IDFC FIRST Bank website i.e. www.idfcfirstbank.com

S.No.	Demand Notice No.	(i) Demand Amount	(ii) Agreement ID	(iii) Name of Borrower(s) and Guarantor(s)	(iv) MORTGAGED PROPERTY ADDRESS	(v) Reserve Price Amount	(vi) EMD Amount	(vii) Date and Time of Auction	(viii) Date and Time of EMD Auction	(ix) Date and Time of Inspection	(x) Date and Time of Auction	Authorized Officer Name & Contact Number
1	INR 789120.00/-	5823989	5823989	Murli Prasad Fulwariya & Nimala Murli Fulwariya	All The Piece And Parcel Of Plot No 54, Admeasuring 40.15 Sq. Mtr. I.E. 162.00 Sq. Ft. I.E. 48.00 Sq. Yards, "Saran Residency", Situated At Revenue Survey No. 65, Block No. 05 (As Per 7 X 12 Block No. 95/94), Admeasuring He. 2.33-08 Sq. Mtr. I.E. 23.308 Sq. Mtr. Moje Village Kanki, Tal. Palana, Dist. Surat, Gujarat - 394310, And, Bounded As-East: Ad. Block, West: Society Road, North: Plot No.85 & South: Plot No.83	INR 789120.00/-	INR 789120.00/-	30-May-2024	29-May-2024	24-May-2024	24-May-2024	Name- Sayendra Manjya Contract Number- 836001848 Name- Chinmay Acharya Contract Number- 957448844
2	INR 729900.00/-	1277063	1277063	Yug Kreation, Kundan Sahikya & Sanjaych C Sahikya	The Property bearing Plot No. 1-A, 4A, 5A, 6B, 21B, 22B, 34B, 76A, 77A totally admeasuring 2867.44 sq.mts. i.e. 3429.44 Sq.Yards along with 1140.17 sq.mts. Undivided Share in the Land of Road & 467.86 sq.mts. Undivided share in the Land of C.O.P. Totally 4483.26 sq.mts. in "Green Garden" Situated at Revenue Survey / Block No.519 Admeasuring He. Aze 4-06-71 sq.mts. Ajar Rs.4067 Paisa, of Moje Village Chhavanada, Tal. Valad, Dist. Valad.	INR 729900.00/-	INR 729900.00/-	30-May-2024	29-May-2024	24-May-2024	24-May-2024	Name- Himanshu Singh Contract Number- 952117755 Name- Chinmay Acharya Contract Number- 957448844
3	INR 122997.00/-	1183541	1183541	Manoj A Vandra (Legal Heir of Anand Rameshbhai Vandra), Harshabhai Poriya (Legal Heir of Anand Rameshbhai Vandra), Ashvinbhai A Vandra, Adhvi Hai of Anand Rameshbhai Vandra), Bhavabhai Tank (Legal Heir of Anand Rameshbhai Vandra & Kundan Manojbhai Vandra	All the piece and parcel of the property consisting of Flat 101, 104, 105, Tots, Units, Stairam, Nageswari, Udhava Nageswari Drossil Road, Opp. Keshavnagar, Surat - 394201	INR 122997.00/-	INR 122997.00/-	30-May-2024	29-May-2024	24-May-2024	24-May-2024	Name- Himanshu Singh Contract Number- 952117755 Name- Chinmay Acharya Contract Number- 957448844
4	INR 995522.24/-	4135783	4135783	Rajaji Mehta, Hebalben Shambhaji Thummar & Bharkumar M Thummar	Immovable Property, Premises of as per Passing Plan "Building A/2 Pakse", West/Floor Plot No. 101, (excess area Building No. A-41, First Floor, Flat No. 101, admeasuring 569.26 sq. ft. i.e. 52.89 sq.mts. built up area) along with proportionate Undivided Land share in Ground, Road, & COP admeasuring 36.8 sq. mtrs. having common Upright right of Parking, Stair case, Passage, Over Head Tank, Drainage, Boring, Terrace etc." "Om Township Vibhici" 3 Organised & developed by "M D Infra Developers" (a partnership firm) developed upon and situated in State of Gujarat, Dist. Surat, Sub-District, Taluka - Karmve, Moje - Village Pasodara Bearing Revenue Survey No. 176, Block No. 177	INR 995522.24/-	INR 995522.24/-	30-May-2024	29-May-2024	24-May-2024	24-May-2024	Name- Himanshu Singh Contract Number- 952117755 Name- Chinmay Acharya Contract Number- 957448844
5	INR 5353776.00/-	1391346 & 1391302	1391346 & 1391302	Ruchi Tech. Mr. Rakesh Babubhai Jain & Mrs. Renu R. Jain	Property-1-Shop No. 310, All The Part And Parcel of Property Bearing No. 650/3, 310/1 The 3rd Floor, Admeasuring 12.64 Sq.Mtrs. Carpet Area, & 15.79 Sq.Mtrs. Built Up Area, Along With Undivided Share in The Land Of "Kamla Textile Market", Situated At City Survey No. 2885-C-141-B Paki of Ward No. 3, Private Plot No. 26-C-D-E Admeasuring 500 Sq. Yards I.E. 459.87 Sq.Mtrs. Moje Malini Vadi, Pipardi Sheri, Salabatpura, City of Surat And Bounded - East: Shop No. 309, West: Shop No. 311, North: Passage & South: other Property Property-2-Shop No. 311, All The Part And Parcel of Property Bearing No. Shop No. 311, The 3rd Floor, Admeasuring 12.64 Sq.Mtrs. Carpet Area, & 15.79 Sq.Mtrs. Built Up Area, Along With Undivided Share in The Land Of "Kamla Textile Market", Situated At City Survey No. 2885-C-141-B Paki of Ward No. 3, Private Plot No. 26-C-D-E Admeasuring 500 Sq. Yards I.E. 459.87 Sq.Mtrs. Moje Malini Vadi, Pipardi Sheri, Salabatpura, City of Sure And Bounded- East: Shop No. 310, West: Shop No. 312, North: Passage & South: other Property Property-3-Shop No. 312, All The Part And Parcel of Property Bearing No. Shop No. 312 on the 3rd Floor, Admeasuring 12.64 Sq.Mtrs. Carpet Area, & 15.79 Sq.Mtrs. Built Up Area, Along With Undivided Share in The Land Of "Kamla Textile Market", Situated At City Survey No. 2885-C-141-B Paki of Ward No. 3, Private Plot No. 26-C-D-E Admeasuring 500 Sq. Yards I.E. 459.87 Sq.Mtrs. Moje Malini Vadi, Pipardi Sheri, Salabatpura, City of Sure And Bounded- East: Shop No. 310, West: Shop No. 312, North: Passage & South: other Property Property-4-Shop No. 312 on the 3rd Floor, Admeasuring 12.64 Sq.Mtrs. Carpet Area, & 15.79 Sq.Mtrs. Built Up Area, Along With Undivided Share in The Land Of "Kamla Textile Market", Situated At City Survey No. 2885-C-141-B Paki of Ward No. 3, Private Plot No. 26-C-D-E Admeasuring 500 Sq. Yards I.E. 459.87 Sq.Mtrs. Moje Malini Vadi, Pipardi Sheri, Salabatpura, City of Sure And Bounded- East: Shop No. 310, West: Shop No. 312, North: Passage & South: other Property Property-5-Shop No. 312 on the 3rd Floor, Admeasuring 12.64 Sq.Mtrs. Carpet Area, & 15.79 Sq.Mtrs. Built Up Area, Along With Undivided Share in The Land Of "Kamla Textile Market", Situated At City Survey No. 2885-C-141-B Paki of Ward No. 3, Private Plot No. 26-C-D-E Admeasuring 500 Sq. Yards I.E. 459.87 Sq.Mtrs. Moje Malini Vadi, Pipardi Sheri, Salabatpura, City of Sure And Bounded- East: Shop No. 310, West: Shop No. 312, North: Passage & South: other Property Property-6-Shop No. 312 on the 3rd Floor, Admeasuring 12.64 Sq.Mtrs. Carpet Area, & 15.79 Sq.Mtrs. Built Up Area, Along With Undivided Share in The Land Of "Kamla Textile Market", Situated At City Survey No. 2885-C-141-B Paki of Ward No. 3, Private Plot No. 26-C-D-E Admeasuring 500 Sq. Yards I.E. 459.87 Sq.Mtrs. Moje Malini Vadi, Pipardi Sheri, Salabatpura, City of Sure And Bounded- East: Shop No. 310, West: Shop No. 312, North: Passage & South: other Property	INR 5353776.00/-	INR 5353776.00/-	30-May-2024	29-May-2024	24-May-2024	24-May-2024	Name- Himanshu Singh Contract Number- 952117755 Name- Chinmay Acharya Contract Number- 957448844
6	INR 3267378.00/-	5605841	5605841	Shree Ram Thrad & Raji, Jayantibhai Babubhai Akhaja & Jayukam Kamal Babubhai Patel	Property - 1 Plot No. C-171, C-type, Avadhani Society, District Surat, Sub-District & Taluka Choryas, Moje/ Pal bearing revenue survey nos. 2651, 2652 & 2681, block no. 242, T.P Scheme No. 161, Surat, Gujarat - 395000/Property-2 Plot No. C-173, C-type, Avadhani Society, District Surat, Sub-District & Taluka Choryas, Moje/ Pal bearing revenue survey nos. 2651, 2652 & 2681, block no. 242, T.P Scheme No. 161 (Pal), Final Plot No. 161, Surat, Gujarat - 395000	INR 3267378.00/-	INR 3267378.00/-	30-May-2024	29-May-2024	24-May-2024	24-May-2024	Name- Himanshu Singh Contract Number- 952117755 Name- Chinmay Acharya Contract Number- 957448844
7	INR 250000.00/-	26691702	26691702	Dubey Ramkant Ghanshyam & Dubey Manju	All The Part And Immovable Property Bearing Flat No. A-102 Admeasuring 640 Sq. Ft. I.E. 59.49 Sq. Mtr. Super Built Up Area And Built-Up Area Admeasuring 320 Sq. Ft. I.E. 29.74 Sq. Mtr. Alongwith Proportionate Undivided Share Admeasuring 6.92 Sq. Mtr. in Road & Cop of Building, Building No. A First Floor, "Suryaksha Palace", Situated At State-Gujarat, District. Surat, Sub-District & Taluka Palana, Moje. Keshavnagar Revenue Survey No. 102/1, 102/2, Block No. 104, 105 Paki Na Land Paki "Shyam Residency" Pakse Plot No. 80, 81, 82, 83, 85 Admeasuring 184.2 Sq. Mtr. Moje Malini Vadi, Pipardi Sheri, Salabatpura, West. 00 Mts. Wide Road, North: Ad. Pits & South: 7.50 Mts Wide Road	INR 250000.00/-	INR 250000.00/-	30-May-2024	29-May-2024	24-May-2024	24-May-2024	Name- Sayendra Manjya Contract Number- 836001848 Name- Chinmay Acharya Contract Number- 957448844
8	INR 393660.00/-	26691157	26691157	Mr. Sagarbhai Bhalerao, Mrs. Ashash Bhalerao & Ashaben Workers	All The Part And Parcel Of Flat No. 305, Admeasuring 5422.00 Sq. Meters, Building No. B/3, Vinay Complex, Opp. Diamond Park, BH Sachin Gade, Pal Keshavnagar, Pal Village, Sachin, Gujarat - 396200, White & Bounded As: East: Flat No. B/304, South: Open Plot, West: Flat No. B/306 & North: Passage	INR 393660.00/-	INR 393660.00/-	30-May-2024	29-May-2024	24-May-2024	24-May-2024	Name- Sayendra Manjya Contract Number- 836001848 Name- Chinmay Acharya Contract Number- 957448844
9	INR 250000.00/-	26692263	26692263	Onkar Kumar & Kajal Kumari	Flat No A 202 Gurukrupa Palace Kadodara Palana Rural Bounded-On Or Towards The East: On Or Towards The West: Road, On Or Towards The North: Flat No. 201 & On Or Towards The South: Road.	INR 250000.00/-	INR 250000.00/-	30-May-2024	29-May-2024	24-May-2024	24-May-2024	Name- Sayendra Manjya Contract Number- 836001848 Name- Chinmay Acharya Contract Number- 957448844
10	INR 20547900.00/-	9062115	9062115	Shantay Associates M. Kausik J. Bidwala, Mrs. Kimpabai Bidwal, Mr. Sheebhan K. Bidwala & Anjwala S Bidwala	All The Part And Parcel Of Immovable Property Bearing Shop No. 301 To 306, 306A, 307 To 314, 314A, 315 To 318 On 3rd Floor Totally Admeasuring 6996 Sq.Ft, Super Built Up Area & 174.96, 204.12, 227.14, 162.48, 146.01, 119.01, 61.01, 143.75, 145.36, 193.03, 221.23, 177.43, 15.84, 116.75, 114.61, 66.80, 191.53, 191.53, 117.12, 201.94 Sq.Ft. Respectively Carpet Area, Along With Undivided Share in The Land Of "R World Block No. 3C", Situated At Revenue Survey No. 44/1A, Block No. 54, T.P Scheme No. 34 (H&A), B&B, Final Plot No. 102, Near Final Plot No. 102, World Block No. 3, 5 & 6 T Of Moje Dumbhal, City Of Surat, And Bounded-East: Passage, West: Open Space, North: Passage & South: Open Space	INR 20547900.00/-	INR 20547900.00/-	30-May-2024	29-May-2024	24-May-2024	24-May-2024	Name- Himanshu Singh Contract Number- 952117755 Name- Chinmay Acharya Contract Number- 957448844

Panchmahal Steel Limited

Registered Office: GIDC Industrial Estate, Kalod-389 330, Dist. Panchmahals, Gujarat
CIN: L27104GJ1972PL2002153. Phone No: 0276-2300715. Fax No: 0276-230889
Email: shares@panchmahalsteel.co.in Website: www.panchmahalsteel.co.in

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2024

Sr. No.	Particulars	Quarter ended		Year ended	
		31-03-2024 (Audited)	31-12-2023 (Unaudited)	31-03-2024 (Audited)	31-03-2023 (Audited)
1	Total Income	9,957.26	10,422.92	13,005.10	43,186.14
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	324.54	(44.03)	149.26	391.88
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	324.54	(44.03)	149.26	391.88
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	244.47	(32.25)	107.58	296.92
5	Total Comprehensive Income for the period (comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	243.74	(29.12)	141.32	305.58
6	Equity Share Capital	1,907.83	1,907.83	1,907.83	1,907.83
7	Reserves including: Retention Reserve			1,378.00	1,347.45
8	Earnings Per Share (of ₹ 10/- each)				
a)	Basic	1.28	(0.17)	0.56	1.56
b)	Diluted	1.28	(0.17)	0.56	1.56

Note: The above is an extract of the detailed format of Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, the full format of the Audited Financial Results is available on the website of Stock Exchange at www.sebiindia.com and also on the Company's website at www.panchmahalsteel.co.in

By order of the Board
Ashok Malhotra
Chairman & Managing Director
DIN - 00120195

Place: Vadodra
Date: 11-05-2024

DEBT'S RECOVERY TRIBUNAL-II
3rd Floor, Bhubhalbai Chambers, Near Keshavnagar, Paldi, Ahmedabad, Gujarat.

THROUGH THE RECOVERY OF DEBTS DUE TO BANK AND FINANCIAL INSTITUTIONS ACT, 1993
EXECUTION / SALE NOTICE
READ WITH REGD. AD / DASTI / AFFIXATION / BEAT OF DRUM / PUBLICATION

RP / RC No. 413/2018
Certificate Holder Name: IDFC Bank Ltd., Vs. Certificate Debtors: Shree Ashapura Trading Company & Ors.

To, C.A. No. 1: Shree Ashapura Trading Company, Represented by its Proprietor Padmanab Chhappam Dewasi, Vill. Kotda Ahemdas, Tal. Bhuj-Kutch

And Also at House No. C-821, Munda Rajkot Section, Pramukh Swami Nagar, Bhuj - Kutch - 370001

And Also at Shop No. 1, Manji Chambers, Trajpur, Motchi - 363842

C.A. No. 2: Padmanab Chhappam Dewasi, Vill. Kotda Ahemdas, Tal. Bhuj - Kutch

And Also at House No. C-921, Munda Rajkot Section, Pramukh Swami Nagar, Bhuj - Kutch - 370001

And Also at Shop No. 1, Manji Chambers, Trajpur, Motchi - 363842

C.A. No. 3: Padmanab Chhappam Dewasi, Village Kotda Ahemdas, Tal. Bhuj - Kutch

And Also at House No. C-921, Munda Rajkot Section, Pramukh Swami Nagar, Bhuj - Kutch - 370001

And Also at Village: Kotda Ahemdas, Tal. Bhuj - Kutch

The aforesaid Dibs No. 1 to 3 have failed to pay the outstanding dues of Rs. 12,46,56,250 (Rupees Twelve Lakhs Forty Six Thousand Five Hundred Sixty Two and Sixty Paise only) as on 28.03.2021 including interest in terms of judgment and decree dated 03.07.2018 passed in C.A. No. 1196/2017 as per my order dated 21.04.2024 under mentioned property to well as by public auction in the aforementioned matter, the auction sale will be held through "online-auction" https://www.lawcourtsindia.net.

Sl. No.	Description of the property	Reserve Price (Rounded off)	EMD 10% or (Rounded off)
1	All that piece and parcels of the immovable properties bearing Residential Plot No. 97, RLS, No. 1538/ Pakti 1/1 and 1630/ Pakti 1/1 Bhumi Township at: Haldai, Hal, Haldai, Dal, Surendranagar, Gujarat.	Rs. 15,50 Lakhs	Rs. 01,65 Lakhs

EMD shall be deposited by RTGS/NEFT in the account as per details as under:

Beneficiary Bank Name: IDFC Bank Ltd.
Beneficiary Branch Address: Sankesh House-Wadi
Beneficiary Account No.: 175000000441
IFSC Code: IDFC0000249

The bid/advance amount will be Rs. 10,00,00/- Single Lot.

Prospective bidders may avail circular listing from service provider i.e. E-Procurement Technologies Ltd. (Tel: 044-66106 No. 029550291 - 029 6106106) or 1468 / 587 and Mr. Ram Sharma (Mobile No. 900002327) / Helpline E-mail ID : support@e-procurement.net and for any property related queries may contact Mr. Anil Sankhla, (Mob. No. 951299911).

Prospective bidders are advised to visit website: https://www.lawcourtsindia.net for detailed terms & conditions and procedure of sale before submitting their bids.

The prospective bidders are advised to adhere payment schedule of 25% (minus EMD) immediately after fall of hammer / close of auction and 75% within 15 days from the date of payment and if 15th day is on other Holiday, then on immediate next first bank working day. No request for extension will be entertained.

The properties are being put to sale on "as is where is", "as is what is" and "as is whatever" basis and prospective buyers are advised to carry out due diligence properly.

Schedule of auction is under:-

SCHEDULE OF AUCTION

1. Inspection of property: 26.05.2024, Between 11.00 AM to 02.00 PM

2. Last date for receiving bids alongwith earnest money and uploading documents including proof of payment made: 13.06.2024 Upto 05.00 PM

3. Auction: 14.06.2024, Between 12.00 PM to 01.00 PM (with auto extension clause of 03 minutes, till E-Auction ends)

(ANURBA DUBEY)
RECOVERY OFFICER, DEBTS RECOVERY TRIBUNAL - II, AHMEDABAD

Date: 13.05.2024

Disclaimer: Please note that the said notice is issued for sale of immovable property only and IDFC FIRST Bank Limited has no right to sale of the movable assets, if any, present at the immovable property.

Sd/-
Authorized Officer
IDFC FIRST Bank Limited (Formerly known as IDFC Bank Ltd)

Sl. No.	Particulars	Standalone		Consolidated			
		Quarter ended	Year ended	Quarter ended	Year ended		
		31-03-2024	31-03-2023	31-03-2024	31-03-2023		
		Audited	Refer Note 2	Audited	Refer Note 2	Audited	
1	Total Income from Operations	1,51,365	1,38,794	4,05,432	1,51,365	1,38,794	4,05,432
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extraordinary Items)	34,794	27,804	38,287	34,794	27,804	38,287
3	Net Profit / (Loss) for the period (after tax (after Exceptional and / or Extraordinary Items))	34,794	27,804	38,287	34,794	27,804	38,287
4	Net Profit / (Loss) for the period (after tax (after Exceptional and / or Extraordinary Items))	25,713	15,822	28,302	25,680	15,769	28,177
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	27,876	20,964	28,333	27,842	20,911	28,809
6	Paid up Equity Share Capital	4,164	4,164	4,164	4,164	4,164	4,164
7	Reserves (including Revaluation Reserve)	2,80,106	2,35,337	2,69,106	2,62,576	2,37,501	2,62,576
8	Security Premium Account	61,204	61,204	61,204	61,204	61,204	61,204
9	Net worth	2,84,283	2,39,514	2,84,283	2,86,734	2,42,108	2,86,734
10	Fixed and Other Capital / Outstanding Debt	-	-	-	-	-	-
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-	-	-
12	Debt Equity Ratio	0.02	0.15	0.02	0.02	0.15	0.02
13	Earnings per Share (of ₹10/- each) (for continuing and discontinued operations)						
1. Basic	61.75	37.89	67.96	61.66	37.87	67.66	
2. Diluted	61.75	37.89	67.96	61.66	37.87	67.66	
14	Dividend Distribution Reserve	-	-	-	-	-	-
15	Debt Service Coverage Ratio	34.96	25.09	12.45	34.96	25.05	12.45
16	Interest Service Coverage Ratio	33.44	23.78	18.81	33.40	23.74	18.78

Notes: 1. The Board of Directors had approved an Interim Dividend of ₹ 5/- per equity share on 08.02.2024. Further, the Board of Directors have recommended a Final Dividend of ₹ 15.50/- per equity share for the year ended 31.03.2024, aggregating to ₹ 20.50/- per equity share.
2. The figures for the quarter ended March 31, 2023 and the balancing figures between the published year-to-date figures in respect of the year ended March 31, 2023 (which were subjected to annual review) and published figures for nine months ended December 31, 2022 and the figures for the quarter ended March 31, 2024 are the balancing figures between the published year-to-date figures in respect of the year ended March 31, 2024 (which were subjected to annual review) and published figures for nine months ended December 31, 2023.
3. Above is an extract of the detailed format of Quarterly and Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI LODR Regulations. Full format of the Quarterly and Annual Financial Results is available at the website of the stock exchanges NSE at www.nseindia.com, the BSE at www.bseindia.com and company's website at www.bemlindia.in.

By order of the Board for BEML Limited
Shantanu Roy
Chairman and Managing Director

Place: BENGALURU
Date: 12.05.2024

Sl. No.	Particulars	Quarter ended		Year ended	
		31-03-2024	31-12-2023	31-03-2023	31-03-2024
		(Audited)	(Unaudited)	(Audited)	(Audited)
1	Total Income	9,957.26	10,422.92	13,005.10	43,186.14
2	Net Profit / (Loss) for the period (before tax, Exceptional and/or Extraordinary Items)	324.54	(44.03)	149.26	391.88
3	Net Profit / (Loss) for the period (after tax (after Exceptional and/or Extraordinary Items))	324.54	(44.03)	149.26	391.88
4	Net Profit / (Loss) for the period (after tax (after Exceptional and/or Extraordinary Items))	244.47	(32.25)	107.58	296.92
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	243.74	(29.12)	141.32	305.58
6	Equity Share Capital	1,907.83	1,907.83	1,907.83	1,907.83
7	Reserves excluding Revaluation Reserve	-	-	-	1,378.05
8	Earnings Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations)				
a) Basic	1.28	(0.17)	0.56	1.56	
b) Diluted	1.28	(0.17)	0.56	1.56	

Note: The above is an extract of the detailed format of Audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015. The full format of the Audited Financial Results is available on the website of Stock Exchange at www.bseindia.com and on the company's website at www.panchmahalsteel.co.in

By order of the Board
Ashok Mathur
Chairman & Managing Director
DIN - 00120198

Place: Vadodra
Date: 11-05-2024

AMBO AGRITEC LIMITED
CIN: U15419WB1994PLC064993
Regd. Office: 3 Pretoria Street, Chandrakunj Building, 2nd Floor, Kolkata - 700071, West Bengal
Website: www.amboagritec.com Email ID: info@amboagritec.com Phone No.: 933 46003333

NOTICE OF EXTRA ORDINARY GENERAL MEETING OF THE COMPANY TO BE HELD THROUGH VIDEO CONFERRING (VCO) OTHER AUDIO VISUAL

NOTICE is hereby given that the Extra Ordinary General Meeting (EGM) of the members of the Company will be held on Monday, 30 June, 2024 at 03.00 p.m. (IST) through Video Conferencing (VCO) Other Audio Visual Means (OAVM) with physical presence of the members at a common venue, in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder (the "Act"), Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") read with General Circular No. 14/2020 dated 8th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020, General Circular No. 20/2020 dated 29th May, 2020 and General Circular No. 10/2022 dated 29th December, 2022 issued by the Ministry of Corporate Affairs ("MCA") and SEBI Circular dated 5th January, 2023, (Collectively referred to as "Circulars") to transact by electronic means as set out in the Notice of Extraordinary General Meeting. Members will be able to attend and participate in the EGM by VCO/AVM only. Members attending through VCO/AVM will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act.

In compliance with the aforesaid Circulars the Company has sent Notice of EGM by electronic mode only, on Friday, 10th May, 2024, to all the members whose email addresses are registered with the Depository Participants up to Friday, 30th May, 2024. The Notice of the EGM can be downloaded from the Company's website at www.amboagritec.com and website of the stock exchange, i.e. BSE Limited at www.bseindia.com and website of National Securities Depository Limited ("NSDL"), i.e. www.evoting.nsdl.com.

REMOTE VOTING AND E-VOTING AT THE EGM
Pursuant to Section 108 of the Act read with Rule 20 of the Companies (Management & Administration) Rules, 2014, Regulation 44 of the Listing Regulations and Secretarial Standards of General Meetings, the Company has engaged services of NSDL for providing remote e-voting facility prior to EGM ("remote e-voting"). Additionally, the Company, through NSDL, is providing the facility of voting through e-voting system during the EGM ("e-voting").

Cut-off date for e-voting
Monday, 27th May, 2024

Commencement of Remote e-voting
9:00 a.m. (IST) on Friday, 31st May, 2024

Conclusion of Remote e-voting
9:00 p.m. (IST) on Sunday, 2nd June, 2024

Members who will be present at the EGM through VCO/AVM and who will not cast their vote by remote e-voting, will be eligible to exercise their right to vote at the EGM. Members who have cast their vote by Remote e-voting prior to the EGM may also attend and participate in the EGM but shall not be entitled to cast their vote again.

Accordingly, members may cast their votes through remote e-voting and e-voting at the EGM by following the instructions mentioned in the Notice. Once the vote on a Resolution is cast by the Member, he/she shall not be allowed to change it subsequently. The Company has appointed Mr. Abhishek Vitorwala (Membership No.2871) Practising Company Secretary to act as a Scrutinizer for monitoring remote e-voting process and e-voting at the EGM in fair and transparent manner. The results of e-voting shall be declared within two working days from conclusion of the EGM. The results declared along with the Scrutinizer's Report shall be communicated to the Stock Exchange and will be placed on the website of the Company at www.amboagritec.com and on the website of Camo Corporate Services Limited ("Camo") at www.camocorp.com.

Members will be able to attend the EGM through VCO/AVM facility provided by using NSDL's Remote e-voting login credentials and following the instructions mentioned in the Notice.
Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after its date of incorporation and is holding shares as of the cut-off date i.e. Friday, 30th May, 2024 may obtain the log ID and password by sending a request at helpdesk.evoting@nsdl.com. However, if he/she is already registered with NSDL for remote e-voting then he/she can use his/her existing User ID and password for casting the vote.

Members who need assistance before or during the EGM, can contact NSDL helpdesk by sending a request at mailto: evoting@nsdl.com or call at 022-4688 7000. Additionally, members may also contact Camo by sending a mail to camo@camocorp.com.

Members are requested to carefully read all the Notes set out in the Notice of EGM and in particular, instructions regarding joining the EGM, manner of casting vote through Remote e-voting or through e-voting during the EGM.

For Ambo Agritec Limited
By Order of the Board of Directors
Umesh Kumar Agasthi
Managing Director
DIN - 0021027

For Dharani Sugars and Chemicals Limited
E P Sakthivel
Company Secretary

Hariom
HOAC FOODS INDIA LIMITED
CORPORATE IDENTIFICATION NUMBER: U15120DL2016PLC330798

Our Company was originally incorporated with the name of "Hood NP-Res-Spices Manufacturer Private Limited" on March 12, 2016 under the Companies Act 2013, with Registrar of Companies, Delhi bearing registration number 330739. Thereafter, the company name was changed to "Hac Foods India Private Limited" dated November 03, 2021. Subsequently, our Company was de-linked from its name and converted to a public limited company pursuant to a resolution passed by our Shareholders at an Extraordinary general meeting held on October 15, 2023 and converted to a public limited company with the name of "Hac Foods India Limited" and a fresh certificate of incorporation dated 30th October, 2023 was issued by the Registrar of Companies, Delhi at New Delhi.

Registered Office: C-09B, 1st Floor, Preetam Extension, Sector-7 Dwarka, Raj Nagar-11, South West Delhi, New Delhi, India, 110077
Telephone: +91 85272 73940. Email: info@hariom.com. Website: www.hoacfoodsindia.com
Contact Person: Ms. Bhavana Agrawal, Company Secretary and Compliance Officer.

PROMOTERS OF OUR COMPANY: MR. RAMBHAU THAKUR, MRS. GAYTRI THAKUR AND MR. YASHWANT THAKUR

The issue is being made in accordance with Chapter IX of the SEBI (ICDR) Regulations (IPO of Small and Medium Enterprises) and the equity shares are proposed to be listed on SME platform of National Stock Exchange of India Limited ("NSE Emerge").

PUBLIC ISSUE OF UP TO 11,55,000 EQUITY SHARES OF FACE VALUE ₹ 10 EACH ("EQUITY SHARES") OF HOAC FOODS INDIA LIMITED (THE "ISSUE") OR THE "ISSUE") FOR CASH AT A PRICE OF ₹ 48 PER EQUITY SHARE (INCLUDING A PREMIUM OF ₹ 38 PER EQUITY SHARE) (THE "ISSUE PRICE"). AGGREGATING UP TO ₹ 554.40 LAKHS ("ISSUE") OF THE ISSUE, 93,000 EQUITY SHARES AGGREGATING TO ₹ 44.54 LAKHS WILL BE RESERVED FOR SUBSCRIPTION BY MARKET MAKER ("MARKET MAKER RESERVATION PORTION") THE ISSUE LESS MARKET MAKER RESERVATION PORTION. E-ISSUE OF 10,62,000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH AT AN ISSUE PRICE OF ₹ 48 PER EQUITY SHARE (INCLUDING A PREMIUM OF ₹ 38 PER EQUITY SHARE) (THE "E-ISSUE"). THE ISSUE AND MARKET MAKER RESERVATION PORTION WILL CONSTITUTE 90.05% AND 27.63%, RESPECTIVELY OF THE POST ISSUE PAID UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY. FOR FURTHER DETAILS, SEE "TERMS OF THE ISSUE" ON PAGE 199 OF THE PROSPECTUS.

THIS ISSUE IS BEING IN TERMS OF CHAPTER IX OF THE SEBI (ICDR) REGULATIONS, 2018 AS AMENDED FROM TIME TO TIME.
For further details see "TERMS OF THE ISSUE" beginning on page no. 199 of the Prospectus.
THE FACE VALUE OF THE EQUITY SHARES IS ₹ 10/- EACH AND THE ISSUE PRICE IS ₹ 48/- . THE ISSUE PRICE IS 4.8 TIMES OF THE FACE VALUE.

BID/ISSUE PERIOD
BID/ISSUE OPENED ON: THURSDAY MAY 16, 2024
BID/ISSUE CLOSED ON: TUESDAY MAY 21, 2024

Minimum Lot Size: 3,000 EQUITY SHARES FOR RETAIL INDIVIDUAL INVESTORS.
Lot Size: 6,000 EQUITY SHARES AND IN MULTIPLES OF 3,000 EQUITY SHARES THEREAFTER FOR HNI/QIP CATEGORY.

UPN mandate end time and date shall be at 5:00 pm on Bid/Offer Closing Date.

RISKS TO INVESTORS

- We are required to obtain, renew or maintain statutory and regulatory permits, licenses and approvals to operate our business and our manufacturing facility, and any delay or inability in obtaining, renewing or maintaining such permits, licenses and approvals could affect our results of operations.
- The Merchant Banker associated with the issue has handled 23 public issues in the past two years out of which no issues closed below the issue price on Listing date.
- Average cost of acquisition of Equity Shares held by our Promoters Rambhau Thakur, Gaytri Thakur and Yashwant Thakur are Rs. 6.34, Rs. 2.63 and Rs. 85.00 per Equity Share and the Issue Price is ₹ 48 per Equity Share.
- The Price/Earnings ratio based on Diluted EPS for year ended March 2023 for the company at the Issue Price is 15.05.
- Weighted Average Return on Net Worth for Fiscals 2023, 2022 and 2021 is 34.67%.

Submission of Bids:
Bid Issue Period (except the Bid/ Issue Closing Date)
Submission and Revision Bids: Only between 10.00 a.m. and 5.00 p.m. IST
Bid Offer Closing Date
Submission and Revision in Bid*: Only between 10.00 a.m. and 3.00 p.m. IST
Submission of Bids by QIBs and Non-Institutional Bidders: Only between 10.00 a.m. and 4.00 p.m. IST
Submission of Bids by Retail Individual Bidders: Only between 10.00 a.m. and 5.00 p.m. IST
UPN mandate end time and date shall be at 5:00 pm on Bid/Offer Closing Date.

IN TERMS OF THE SEBI CIRCULAR BEARING NUMBER: CIR/CFD/POLICYCELL/11/2015, DATED NOVEMBER 10, 2015 AND ALL THE POTENTIAL INVESTORS SHALL PARTICIPATE IN THE BIDDING THROUGH AN ASBA FACILITY THROUGH THE BANK ACCOUNT WHICH WILL BE BLOCKED BY THE SEBI CERTIFIED DEPOSITARY BANK ("SCDSB") FOR THE SAME. FURTHER PURSUANT TO SEBI CIRCULAR BEARING NO. SEBI/HOAC/CFD/LOD/CP/2019/76 DATED JUNE 23, 2019, FOR IMPLEMENTATION OF PHASE I FOR UP FACILITY WHICH IS EFFECTIVE FROM JULY 01, 2019, ALL POTENTIAL BIDDERS (EXCEPT ANCHOR INVESTORS) ARE REQUIRED TO MANUALLY UTILIZE THE APPLICATION SUPPORTED BY BLOCKED AMOUNT ("ASBA") FOR ALL THE BIDDING. ALL THE BIDDERS ARE REQUIRED TO PROVIDE THEIR RESPECTIVE ASBA ACCOUNTS OR UPN IN CASE OF NIS, IN WHICH THE CORRESPONDING APPLICATION AMOUNTS WILL BE BLOCKED BY THE SCDSB UNDER THE UP MECHANISM OF APPLICATION. FOR DETAILS IN UPN REGD. SPECIFIC ATTENTION IS INVITED TO "ISSUE PROSPECTUS" ON PAGE NO. 208 OF THE PROSPECTUS, IN CASE OF DELAY IF ANY UNBLOCKING/REFUND OF THE FUND, OUR COMPANY SHALL BE INTERESTED ON THE APPLICATION MONEY AT THE RATE OF 18% PER ANNUM FOR THE PERIOD OF UPN.

Application shall be filed on the Bid cum Application Form that shall be available on the website of PAN, DP ID and Client ID provided in the Bid cum Application Form. The Bidders/Applicants may be deemed to have authorized the Depositories to provide to the Registrar to the Issue, any requested Demographic Details of the Applicants as available on the records of the depositories. These Demographic Details may be used, among other things, for or unblocking of ASBA Account or for other correspondence(s) related to an issue. Applicants are advised to update any changes to their Demographic Details as available in the records of the Depository Participant to ensure accuracy of records. Any discrepancy arising from failure to update the Demographic Details provided in the Bid cum Application Form shall be at the Applicant's sole risk. Applicants should ensure that PAN, DP ID and Client ID are correctly filled in the Bid cum Application Form. The PAN, DP ID and Client ID provided in the Bid cum Application Form should match with the PAN, DP ID and Client ID available in the Depository database. Otherwise, the Bid cum Application Form is liable to be rejected. Applicants should ensure that the beneficiary account provided in the Bid cum Application Form is active.

CONTENTS OF THE MEMORANDUM OF ASSOCIATION OF THE COMPANY AS REGARDS ITS OBJECTS: For information on the main objects and other objects of our Company, see "History and Certain Corporate Matters" on page 137 of the Prospectus and Clause III of the Memorandum of Association of our Company. The Memorandum of Association of our Company is a material document for inspection in relation to the Issue. For further details, see the section "Material Contracts and Documents for Inspection" on page 270 of the Prospectus.

LIABILITY OF MEMBERS AS PER MOA: The liability of the members is limited and their liability is limited to the amount unpaid, if any, on the shares held by them.

AMOUNT OF AUTHORIZED SHARE CAPITAL OF THE COMPANY AND CAPITAL STRUCTURE: The Authorized Share Capital of the Company is ₹ 4,00,00,000/- (Rupees Four Crore only) divided into 40,00,000 (Forty Lacs) Equity Shares of Rs.10/- (Rupees Ten only) each. Details of the Capital Structure, see "Capital Structure" on page 59 of the Prospectus.

NAME(S) OF THE SIGNATORIES TO THE MEMORANDUM OF ASSOCIATION OF THE COMPANY AND THE NUMBER OF EQUITY SHARES SUBSCRIBED BY THEM: Given below are the names of the signatories of the Memorandum of Association of the Company and the number of Equity Shares subscribed for by them at the time of signing of the Memorandum of Association of our Company: Mr. Rambhau Thakur - 5,000 Equity Shares, and Ms. Gaytri Thakur 5,000 Equity Shares of Rs.10/- Each. Details of the main objects of the Company are contained in the Memorandum of Association, see "History and Corporate Structure" on page 137 of the Prospectus. For details of the share capital structure, see "Capital Structure" on page 59 of the Prospectus.

LISTING: The Equity Shares issued through the Prospectus are proposed to be listed on the NSE EMERGE ("SME Platform of NSE"). Our Company has received an "in-principle" approval from the NSE for the listing of the Equity Shares pursuant to letter dated May 03, 2024. For the purpose of the Issue, the Designated Stock Exchange shall be NSE Limited (NSE). A signed copy of the Prospectus has been filed for registration to the ROC on May 10, 2024 and Prospectus shall be loaded to the ROC in accordance with Section 26(1) of the Companies Act, 2013. For details of the documents and documents available for inspection from the date of the Prospectus up to the Bid/ Issue Closing Date, see "Material Contracts and Documents for Inspection" on page 270 of the Prospectus.

DISCLAIMER CLAUSE OF SECURITIES AND EXCHANGE BOARD OF INDIA ("SEBI"): Since the issue is being made in terms of Chapter IX of the SEBI (ICDR) Regulations, 2018, the Prospectus has been filed with SEBI. In terms of the SEBI Regulations, the SEBI shall not issue any observation on the Offer Document. Hence there is no such specific disclaimer clause of SEBI on page 199 of the Prospectus.

DISCLAIMER CLAUSE OF NSE (THE DESIGNATED STOCK EXCHANGE): "It is to be distinctly understood that the permission given by NSE should not in any way be deemed or construed that the Offer Document has been cleared or approved by NSE nor does it certify the correctness or completeness of any of the contents of the Offer Document. The investors are advised to refer to the Offer Document for the full text of the Disclaimer Clause of NSE."

GENERAL RISK: Investments in equity and equity related securities involve a degree of risk and investors should not invest any funds in this Issue unless they can afford to take the risk of losing their investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in this Issue. For taking an investment decision, investors must rely on their own examination of the Issue and this Issue, including the risks involved. The Equity Shares have not been recommended or approved by the Securities and Exchange Board of India ("SEBI"), nor does SEBI guarantee the accuracy or adequacy of the contents of the Prospectus. Specific attention of the investors is invited to "Risk Factors" on page 28 of the Prospectus.

ASBA* Simple, Safe, Smart way of Application - Make use of it!!!
Applying to issues by simply blocking the fund in the bank account. Investors can avail the same. For details, check section on ASBA below.
Mandatory in Public Issues from January 01, 2016. No cheque will be accepted.

UPI Now available in ASBA for Retail Individual Investors (RII)!!!
Investors are required to ensure that the bank account used for bidding is linked to their PAN. UPN - Now available in ASBA for RII's applying through Registered Brokers, DP's & RTAs. RII's also have the option to submit the application directly to the ASBA Bank (SCDSB) or to use the facility of linked online trading, demat and bank account. Investors have to apply through the ASBA process. ASBA will be available by all the investors except anchor investor. UPN may be availed by Retail Individual Investors. For details on the ASBA and the UPI process, please refer to the details given in ASBA form and abridged prospectus and also please refer to the section "Issue Procedure" beginning on page 208 of the Prospectus. The process is also available on the website of Association of Investment Bankers of India ("AIBI"), the Stock Exchanges and the General Information Document.

*ASBA forms can be downloaded from the website of NSE EMERGE ("SME Portal of NSE")
*If not of banks supporting UPI is also available on the website of SEBI at www.sebi.gov.in. iCIB Bank Limited has been appointed as Sponsor Bank for the Issue. In accordance with the provisions of the November 1, 2016, as amended, for UPI related queries, investors can contact NPI at the toll free number-1800 202 140 and Mail-to: ipo.upi@npi.org.in or for the list of UPI Apps and Banks use on UPI, please refer to the link www.sebi.gov.in. For issue related guidance investors may contact: CIPR Capital Advisors Private Limited- At: Mohi Baid (+91 87775 64648) (Email:it.investors@icibcapitaladvisors.com).

BOOK RUNNING LEAD MANAGER TO THE ISSUE	REGISTRAR TO THE ISSUE	COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER
GYR CIPR Capital Advisors	AKFINTECH KFINTECH SERVICES LIMITED Solemn Tower - B, Plot 31-32, Gachowai, Financial District, Narokananga, Sarajewanganj, Hyderabad-500 032, Telangana, India. Tel No: +91 40 6716 2222 Fax No: +91 40 243 1551 Website: www.kinfintech.com Email: haacfoos@kinfintech.com	Hariom Ms. Bhavana Agrawal is the Company Secretary and Compliance Officer of our Company. Her contact details are set forth in the Prospectus. Registered Office: C-09B, 1st Floor, Preetam Extension Sector-7 Dwarka, Raj Nagar - South West Delhi, New Delhi, India, 110077 Telephone: +91 85272 73940 E-mail: n.c.pliance@hoacfoodsindia.com
GYR CAPITAL ADVISORS PRIVATE LIMITED Address: 428, Gals Empire, Near Jai Tower Drive, Connaught Place, New Delhi-110028, India. Gujarat: +91 87775 64648 Fascimile: +91 87775 64648 E-mailed: info@gyrcapitaladvisors.com Website: www.gyrcapitaladvisors.com Investor Grievance Email: investor.grievance@gyrcapitaladvisors.com Contact Person: Mr. Mahesh Kumar SEBI Registration Number: IM0000012810	KFINTECH SERVICES LIMITED Solemn Tower - B, Plot 31-32, Gachowai, Financial District, Narokananga, Sarajewanganj, Hyderabad-500 032, Telangana, India. Tel No: +91 40 6716 2222 Fax No: +91 40 243 1551 Website: www.kinfintech.com Email: haacfoos@kinfintech.com Investor Grievance Email: investor.grievance@kinfintech.com Contact Person: Mr. M. Murali Krishna SEBI Registration No.: IR0000000221 Phone No: 7240252970 / 112649	Ms. Bhavana Agrawal is the Company Secretary and Compliance Officer of our Company. Her contact details are set forth in the Prospectus. Registered Office: C-09B, 1st Floor, Preetam Extension Sector-7 Dwarka, Raj Nagar - South West Delhi, New Delhi, India, 110077 Telephone: +91 85272 73940 E-mail: n.c.pliance@hoacfoodsindia.com Investors can contact the Company Secretary and Compliance Officer or the M. Mr. Registrar to the Issue in case of any pre-issuance or post-issue related problems, such as non-receipt of the allotment, non-credit of Allotted Equity Shares in the respective beneficiary account and related matters.

AVAILABILITY OF PROSPECTUS: Investors are advised to refer to the Prospectus and the Risk Factors contained therein before applying in the Issue. Full copy of the Prospectus is available on the website of the SEBI at www.sebi.gov.in, website of the Company at www.hoacfoodsindia.com, the website of the L1M to the Issue at www.gyrcapitaladvisors.com, the website of NSE Emerge at https://www.nseindia.com/companies-listing/corporate-listings-offer-documents, respectively.

AVAILABILITY OF APPLICATION FORMS: Application forms can be obtained from the Registrar Office of the Company, D-48B, 1st Floor, Preetam Extension Sector-7 Dwarka, Raj Nagar-11, South West Delhi, New Delhi, India, 110077 Telephone: +91 85272 73940. LM GYR Capital Advisors Private Limited, Telephone: +91 87775 64648 and the Registered Brokers, RTAs and DP's participating in the issue. Application forms will also be available on the website of NSE EMERGE and the Designated Banks of SCDSBs, the list of which is available at www.sebi.gov.in. For details of the documents and documents available for inspection from the date of the Prospectus up to the Bid/ Issue Closing Date, see "Material Contracts and Documents for Inspection" on page 270 of the Prospectus.

ESCRROW COLLECTION BANK/ REFUND BANK/PUBLIC ISSUE ACCOUNT BANK/ SPONSOR BANK/ AXIS BANK LIMITED
All capitalized terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the Prospectus.

On behalf of Board of Directors
HOAC FOODS INDIA LIMITED
Ms. Bhavana Agrawal
Company Secretary and Compliance Officer

Place: New Delhi, India
Date: May 13, 2024

Disclaimer: HOAC FOODS INDIA LIMITED is proposing, subject to applicable statutory and regulatory requirements, receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and has filed the Prospectus with the Registrar of Companies, Delhi & Hyderabad on March 17, 2024 and thereafter with SEBI and the Stock Exchange. Full copy of the Prospectus is available on the website of the SEBI at www.sebi.gov.in, website of the Company at https://www.hoacfoodsindia.com, the website of the L1M to the Issue at www.gyrcapitaladvisors.com, the website of NSE Emerge at https://www.nseindia.com/companies-listing/corporate-listings-offer-documents, respectively. Any potential investors should read full investment in equity shares involves a high degree of risk and for details relating to the same, please refer to the Prospectus including the section titled "Risk Factors" beginning on page 28 of the Prospectus.

The Equity Shares have not been and will not be registered under the U.S. Securities Act of 1933, as amended or any state securities laws in the United States, and unless so registered, and may not be issued or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the Securities Act, 1933 and in accordance with any applicable U.S. State Securities Laws. The Equity Shares are being issued and sold outside the United States in offshore transactions in reliance on Regulation "S" under the Securities Act, 1933 and the applicable laws of each jurisdiction where such issuances and sales are made. There will be no public offering in the United States.

લોકસત્તા જનસત્તા વડોદરા

નર્મદા-ભરૂચ-અર્થકારણ

મોટાપાયે ડિજિટાઇઝેશન, ઈન્ટરનેટ એક્સેસમાં ઊંચાળો અને સોશિયલ મીડિયાના ઉચ્ચ પ્રવેશને લીધે



નવી દિલ્હી, તા.૧૨ મોટા પાયે ડિજિટાઇઝેશન, ઈન્ટરનેટ એક્સેસમાં વધારો અને સોશિયલ મીડિયાના ઉચ્ચ પ્રવેશને લીધે...

ભારતનો પ્રભાવક માર્કેટિંગ ઊદ્યોગ 2026 સુધીમાં વધીને 34 બિલિયન ડોલર થશે

ભારતના ઊદ્યોગ પ્રવેશકોને આગળ વધારવા અને પ્રભાવક માર્કેટિંગ ઊદ્યોગને વધુ વિકસિત કરવા માટે...

નવી દિલ્હી, તા.૧૨ નવા આયત્ન વગર મેગવનનું શરૂ કરવા માટેનો નમો સેક્ટર છે...

સર્વિસ અને પ્રભાવક માર્કેટિંગની સેવાઓને આગળ વધારવા અને પ્રભાવક માર્કેટિંગ ઊદ્યોગને વધુ વિકસિત કરવા માટે...

FMCG ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિયેશન કહે છે

કે શ્રાવેડ મસાલાના સ્ટોકિંગને મર્યાદિત કરો નવી દિલ્હી, તા.૧૨ નવા આયત્ન વગર મેગવનના છે...

સાંભવિતપણે આ ઉદ્યોગના વેચાણ પર નોંધપાત્ર અસર કરી શકે છે, તેથી, ઓઈસી કન્ટ્રીપ્રમર કોર્પોરેશન ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિયેશન (AICPDF) અને આ ઉદ્યોગના વેચાણ પર નોંધપાત્ર અસર કરી શકે છે...

ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા

વિશ્વની આ મોટી કંપની ભારતમાં પાંચ લાખ નોકરીઓ આપશે



નવી દિલ્હી, તા.૧૨ iPhone નીચાના એપલ ભારતમાં પોતાનો બિઝનેસ વધારવાની તૈયારી કરી રહ્યા છે...

એક તરફ, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, તો બીજી તરફ, વિશ્વભરની મોટી કંપનીઓ દેશમાં પોતાનો વ્યવસાય વધારવાની યોજના બનાવી રહી છે...

બોનસ ઈશ્યુના કારણે રિટેલ અને એચએનઆઈનો સ્ટોકમાં રસ વધ્યો

અમદાવાદ, તા.૧૨ બોનસ ઈશ્યુની જાહેરાત ક્યાં પછી, નેશનલ સ્ટોક એક્સચેન્જના બજાર મૂલ્ય વળખે ૨.૮૫,૦૦૦ કરોડ વધીને ૨.૩૨,૧ લાખ કરોડ થઈ છે...

નિષ્ણતાંતો જણાવે છે કે બોનસ ઈશ્યુના કારણે રિટેલ અને એચએનઆઈનો સ્ટોકમાં રસ વધ્યો છે...

રાજપીપળાના વડીલા જકાતનાકાઠી કલાઘોડાનો નવો રોડ બન્યો પરંતુ સ્ટ્રીટ લાઈટના અભાવે અકસ્માત વધ્યા



રાજપીપળા, તા.૧૨ અકસ્માતની ઘટના બનતાં લોકોના જીવ જઈ રહ્યા છે...

બજારના ઘટાડા દરમિયાન મ્યુચ્યુઅલ ફંડની કામગીરીની સમીક્ષા કરવી જરૂર

મ્યુચ્યુઅલ ફંડ્સ: બજારમાં ઘટાડા સાથે પોર્ટફોલિયોને ફરીથી સંતુલિત કરવાનો છે?



નવી દિલ્હી, તા.૧૨ સહ-નસીલીતા અને લાંબા સમયગાળાની ભિન્નિજ ધોળ, તો તમે બજારની મંદી માટે વધુ આત્મચક્રવલ્લભિત અનુભવી શકો છો...

આ પાંચ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરવામાં ધ્યાન રાખજો નહીંતર ઈન્કમેટેક્સ વિભાગની નોટિસ આવી શકે છે

નવી દિલ્હી, તા.૧૨ આરવકાર વિભાગ દ્વારા કરેલ નવા નોટિસ અંતર્ગત...

ભરૂચ તાલુકાના વાસી ગામે કોમી એકતાના પ્રતીક સમાન યોથો સમૂહ લગ્ન ઉત્સવ યોજાવો



ભરૂચ તાલુકાના વાસી ગામે કોમી એકતાના પ્રતીક સમાન યોથો સમૂહ લગ્ન ઉત્સવ યોજાવો

Table with financial data for Panchnah Steel Limited, including quarterly and annual results for FY 2023-24.